

નગરપાલિકા – સોનગઢ

:: ટેન્ડરની જનરલ શરતો ::

- (૧) આ ટેન્ડર આઈટમ રેઈટ બેઈઝ / ટકાવારી રેઈટ બેઈઝ પર માંગવામાં આવેલ છે. શેડ્યુલ આઈટમ સામે કોન્ટ્રાક્ટરે પોતાના ભાવ આંકડામાં તેમજ શબ્દોમાં ભરી કુલ સરવાળો કરવાનો રહેશે. / શેડ્યુલ આઈટમના સરવાળા પર કોન્ટ્રાક્ટરે ટકાવારી મુજબ અંદાજિત કિંમતથી ઉંચા-નીચા ભાવ ભરવાના રહેશે.
- (૨) સદરહુ કામમાં વપરાતા દરેક મટેરીયલ્સના તેમજ ક્યુબના ટેસ્ટીંગ નિયમોનુસાર ‘ગેરી’ અથવા સરકાર માન્ય લેબોરેટરીમાં એજન્સીએ પોતાના ખર્ચે ટેસ્ટીંગ કરાવી રીપોર્ટ નગરપાલિકામાં રજૂ કરવાનો રહેશે અને જયારે એજન્સી દ્વારા ટેસ્ટીંગ રીપોર્ટ કરવામાં નહીં આવે ત્યારે કામના થતા રનીંગ/ફાઈન બિલમાંથી ૧.૦૦% મુજબ થતો ચાર્જ કપાત કરવામાં આવશે અને ટેસ્ટીંગનાં રીપોર્ટ ૧૦% મુજબના ગેરીના અને ૯૦% મુજબના સરકાર માન્ય લેબોરેટરીના રજૂ કરવાના રહેશે.
- (૩) દરેક આઈટમના અંદાજિત જથ્થામાં ગમે તેટલો વધારો કે ઘટાડો થઈ શકશે અને કોઈ આઈટમ સંપૂર્ણપણે રદ થઈ શકશે કે નવી આઈટમ ઉમેરી શકાશે. આમ છતાંય આવી આઈટમ કે આઈટમના જથ્થાના ફેરફારથી ટેન્ડરમાં બતાવેલ આઈટમના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં. કોન્ટ્રાક્ટરને દરેક લાગુ પડતી આઈટમની ચુકવવા પાત્ર થતી રકમ કોન્ટ્રાક્ટ મુજબ સાઈટ પર દેખરેખ થયેલ કામના માપ પરથી ચકાસવામાં આવશે. ટેન્ડરમાં બતાવેલ આઈટમ રેઈટના બદલા જ માલસામાન તથા મજૂરીના ખર્ચનો સમાવેશ થઈ જાય છે અને તે બાબતે કોઈપણ જાતની વધારાની રકમ ચુકવવામાં આવશે નહીં. નવી ઉમેરેલી આઈટમના ભાવ ટેન્ડરમાં તે પ્રકારની આઈટમનાં ભાવ ઉપરથી અથવા તો રેઈટ એનાલીસીસ બનાવીને તે ઉપરથી અથવા તો ચાલુ બજારનાં ભાવો ઉપરથી નગરપાલિકા નક્કી કરે તે મુજબ ઠરાવવાના રહેશે.
- (૪) શેડ્યુલમાંની કોઈ પણ આઈટમ કે આઈટમના વર્ણન કે જથ્થામાં થયેલી ભુલ કે ક્ષતિના કારણે આ કોન્ટ્રાક્ટનો ભંગ થયો ગણાશે નહીં પરંતુ તેને ફેરફાર તરીકે ગણવામાં આવશે.
- (૫) આ ટેન્ડર ઓફરની સાથે ટેન્ડરના તથા ચીફ ઓફિસરના સંયુક્ત નામોની ફિક્સ ડીપોઝીટ રસીદ કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકની અનૅસ્ટમની ડિપોઝીટ પેટે જોડાવાની રહેશે. તેમજ બીલમાંથી ૨.૫૦% મુજબ સિક્યોરીટી ડિપોઝીટ કપાત કરવામાં આવશે. તેમજ ૨.૫૦% મંજૂર થયેથી ભરવાની રહેશે. આમ કપાત કરેલ તથા ભરેલ ડીપોઝીટ મળી કુલ ૫.૦૦% સિક્યોરીટી ડીપોઝીટને પ્રાજેક્ટ સંતોષકારક રીતે પુરા થયે કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યેથી ત્રણ વર્ષ સુધી નગરપાલિકામાં જમા રાખવામાં આવશે અને ટેન્ડર મંજૂર થયેથી ૫.૦૦% મુજબ પરફોર્મન્સ બોન્ડ ડિપોઝીટ એફ.ડી.આર.બેંક ગેરંટી રૂપે જમા કરવાની રહેશે. જે રકમ સંપૂર્ણ કામ પુર્ણ થાય અને ફાઈનલ બિલનાં પેમેન્ટ થયા બાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યા બાદ છુટી કરવામાં આવશે. તેમજ દરેક બિલ થયેલ કામના આઈટમ રેઈટ મુજબની રકમના ૧૦૦% રકમની ચુકવણી કરવામાં આવશે તેમજ દરેક રનીંગ/ફાઈનલ બિલમાંથી અગાઉ ચુકવેલ પેમેન્ટ બાદ કરવામાં આવશે. ૦.૭૫% મુજબ TPI ચાર્જ રનીંગ/ફાઈનલ બિલમાંથી કપાત કરવામાં આવશે.
- (૬) તા. ૧-૭-૨૦૧૭ થી GST (ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ) નું કર માળખું અસ્તિત્વમાં આવેલ છે અને તા. ૧-૭-૨૦૧૭ પહેલા અસ્તિત્વમાં હોય તેવા આડકતરા કર માળખાને સ્થાને GST (ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ) માં નિર્દિષ્ટ કર માળખા અનુસાર ઈજારદારશ્રીઓએ તે મુજબ કર ભરવાનાં રહે છે, તે અનુસાર ઈજારદારશ્રીએ GST (ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ) ના નિયમોને સમજી વિચારી ભરવાપાત્ર કરને ધ્યાને લઈ

તે મુજબ ટેન્ડર ભરવા ખાસ નોંધ લેવી. ઈજારદારશ્રીઓ દ્વારા ટેન્ડર ભર્યા બાદ GST (ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ) ના કર માળખાના કારણે નાણાંકીય ભારણ આવવાની કે નાણાંકીય રાહત આપવાની ઈજારદારશ્રીની કોઈપણ રજૂઆત કે વિવાદ પ્રમુખ/ચીફ ઓફિસર નગરપાલિકા સોનગઢ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

(૭) આ ટેન્ડર ઓફરની કાયદેસરના આ ટેન્ડર ખુલ્લા પછીથી ૯૦ દિવસ સુધીની રહેશે.

(૮) ટેન્ડર ઓફર ભરતા પહેલા ટેન્ડર કામના સ્થળની પુરી તપાસ કરીને જમીનના લેવલ જમીનના પ્રકાર ઇલેક્ટ્રીક પાવર અને પાણી વ્યવસ્થા વિગેરેની સંપૂર્ણ જાણકારી મેળવેલ છે તેમ માનવામાં આવશે. સાઈટ કન્ડીશનને કારણે ઉદભવેલા કોઈપણ દાવાને ધ્યાનમાં લેવામાં નહીં આવે.

(૯) અદ્યુરી અથવા અસ્પસ્ટ ઓફરને ગેરલાયક ઠરાવી શકાશે.

(૧૦) કોઈપણ કારણ દર્શાવ્યા વિના કોઈપણ એક કે બધીજ ટેન્ડર ઓફરો રદ કરવાના કે સ્વિકારવાનો હકક અમોને અબાધીત રાખેલ છે.

(૧૧) પાણી તથા તેને માટે જોઈતી પાઈપ લાઈન તેમજ ઇલેક્ટ્રીકની તમામ વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે કરવાની રહેશે.

(૧૧) કામ અંગેના તમામ હકક અધિકાર નગરપાલિકાને અબાધિત રહેશે.

નગરપાલિકા – સોનગઢ

:: કોન્ટ્રાક્ટની શરતો ::

(૧) સમય મર્યાદા :

અગાઉ જણાવેલ સમય મર્યાદા વર્ક ઓર્ડર આપ્યાની તારીખથી અમલમાં આવી ગયેલ ગણાશે સમય મર્યાદાએ આ કોન્ટ્રાક્ટની અગત્યની શરત ગણાશે એટલે કોન્ટ્રાક્ટરે આ કામ ઉપરોક્ત સમય મર્યાદામાં કે તેથી વહેલુ પુરુ થાય તેવા શક્ય તમામ પ્રયાસો કરવા જરૂરી છે.

રજા દરમિયાન કે રવિવારે કોઈ પણ પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ રાખી શકાશે નહીં. જો સમયમર્યાદાની અથવા તાત્કાલિક કામ પુર્ણ કરવા જરૂરીયાત પડે તો રજા દરમિયાન કે રવિવારે કામ ચાલુ રાખવા માટે કોન્ટ્રાક્ટરે અગાઉથી મ્યુ.એન્જનીયર/કન્સ્ટન્ટશ્રીની બે દિવસ અગાઉ લેખિત મંજૂરી લેવી પડશે અને નગરપાલિકાના હાજર રહેનાર સ્ટાફનો ઓવર ટાઈમ મ્યુનીસીપલ નિયમ મુજબ કોન્ટ્રાક્ટર આપવા બંધાયેલ રહેશે.

(૨) સ્પેસીફિકેશન :

કોન્ટ્રાક્ટરે દરેક કામ સંપૂર્ણપણે સ્પેસીફિકેશન પ્રમાણે જ કરવાના રહેશે. નગરપાલિકા વતી કન્સલ્ટીંગ એન્જનીયરે આપેલ ડિઝાઈન, ડ્રોઈંગ, સ્પેસીફિકેશન કે સુચનાઓ લેખિત સ્વીકારીને આવું કામ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. બધીજ વખતે પી.ડબલ્યુ.ડી. હેન્ડ બુક વોલ્યુમ : ૧ અને ૨ અને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આપેલ સ્ટાન્ડર્ડ સ્પેસીફિકેશન તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સ્પેસીફિકેશનનો અમલ કરવાનો રહેશે.

જ્યારે કોઈ પણ બાબત અગર સ્પેસીફિકેશનનો ટેન્ડર સ્પેસીફિકેશનમાં નિર્દેશ કરવામાં ન આવ્યો હોય તેવા સંજોગોમાં તે બાબતે પી.ડબલ્યુ.ડી. હેન્ડબુક ભાગ એક તથા ત્રણ ની છેલ્લી અદ્યતન આવૃત્તિમાં જણાવ્યા પ્રમાણે કામ કરવાનું રહેશે.

કોન્ટ્રાક્ટરને સ્પેસીફિકેશન, ડ્રોઈંગ, ડિઝાઈન વગેરે માટે નગરપાલિકા એન્જનીયર / કન્સલ્ટન્ટ તરફથી વારંવાર લેખિત હુકમ આપવામાં આવે તે મુજબ કામ ઘણી જ મજબુતાઈથી અને કારીગરીથી કરવું પડશે. કોન્ટ્રાક્ટરને સ્પેસીફિકેશન, ડ્રોઈંગ, ડિઝાઈન વિગેરેની નકલ જોઈએ તો પૈસા આપીને નગરપાલિકા કચેરીમાંથી મળી શકશે.

(૩) દસ્તાવેજોની ગુપ્તતા :

આ ટેન્ડર ડોક્યુમેન્ટમાં આપેલ કોઈપણ જાતના દસ્તાવેજ કે સ્પેસીફિકેશન કે ડ્રોઈંગનો સીધો કે આડકતરી રીતે ટેન્ડર કે કોન્ટ્રાક્ટરના કામે સિવાય બીજા કોઈપણ હેતુ માટે ઉપયોગ કરવો નહીં.

(૪) આખરી નિર્ણય :

સ્પેસીફિકેશન, ડ્રોઈંગ, માપસાઈઝ કામની ગુણવત્તા આઈટમ રેઈટ, બીલ, કોન્ટ્રાક્ટની શરતો, કામનો જથ્થો, કામનો પ્રોગ્રેસ, સમય મર્યાદા, ટેન્ડર શરતોના અર્થ, સ્પષ્ટીકરણ અને મુલ્યાંકન વિગેરે તમામ ટેકનીકલ બાબતો માટે નગરપાલિકાનો નિર્ણય આખરી અને બંને પાર્ટીઓને બંધનકર્તા રહેશે.

(૫) પેમેન્ટની શરતો :

(અ) સિક્યોરીટી ડિપોઝીટ એજન્સીએ ભાવ મંજૂર થવાથી ૨.૫૦% મુજબ એફ.ડી.આર. સ્વરૂપે ભરવાની રહેશે તેમજ બિલમાંથી ૨.૫૦% મુજબ કપાત કરવામાં આવશે. આમ કુલ ૫.૦૦% મુજબની સિક્યોરીટી

ડિપોઝીટને પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યેથી ૩ વર્ષ માટે નગરપાલિકામાં વગર વ્યાજે જમા કરવામાં આવશે અને ટેન્ડર મંજૂર થયે ૫.૦૦% મુજબ પરફોર્મન્સ બોન્ડ ડિપોઝીટ એફ.ડી.આર./બેંક ગેરેન્ટી રૂપે જમા કરવાની રહેશે. જે રકમ સંપૂર્ણ કામ પૂર્ણ થાય અને ફાઈનલ બિલના પેમેન્ટ થયા બાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યા બાદ છૂટી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર જો પોતાનું કામ અધુરુ છોડે અથવા તો સમય મર્યાદામાં પુરુ ન કરે તો નગરપાલિકા પોતાના નિર્ણય થી ડિપોઝીટ જપ્ત કરી વસુલ થયેલ ગણાશે.

(બ) કોન્ટ્રાક્ટરના દરેક રનીંગ/ફાઈનલ બિલ તથા કામ પેટેના ચુકવણામાંથી સરકારશ્રીનાં દ્વારાઘોરણ મુજબ ઈન્કમેટેક્સ નગરપાલિકા દ્વારા કપાત કરી સરકારશ્રીના નિયત હેડે ભરી દેવામાં આવશે. તેમજ ૧% (LWC) ફંડ કપાત કરવામાં આવશે.

(ક) મંજૂર થયેલા ભાવો ઉપર કોઈપણ સંજોગોમાં ભાવવધારો (પ્રાઈઝ એક્સલેશન) આપવામાં આવશે નહીં.

(ડ) કોન્ટ્રાક્ટર દર કેલેન્ડર માસમાં વર્ક પ્રોગ્રેસનું દરેકનું એક અથવા બે બીલ રજૂ કરી શકશે.

(૬) પેનેલ્ટી બોનસ :

કોન્ટ્રાક્ટરને આપેલ સમયમર્યાદામાં કોન્ટ્રાક્ટર જો સંતોષકારક રીતે કામ પુરુ ન કરી શકે તો કોન્ટ્રાક્ટર પાસેથી દૈનિક ૧% થી ૧૦% મુજબ જેટલા દિવસ મોડુ થયુ હશે તેટલા દિવસની પેનેલ્ટી નગરપાલિકાના નિર્ણય ઉપર વસુલ કરવામાં આવશે. આ પેનેલ્ટી ઉપરાંત કામ મોડુ પુરુ કરવાની કે કોન્ટ્રાક્ટરની ભંગ કરવાથી નગરપાલિકાને થયેલ સીધી ખોટ કે નુકશાનનું વળતર કોન્ટ્રાક્ટર પાસેથી વસુલ કરવામાં આવશે.

(૭) એક્સ્ટ્રા આઈટમો :

(અ) એક્સ્ટ્રા આઈટમ કે એક્સ્ટ્રા કામો માટેના રેઈટ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ પી.ડબલ્યુ.ડી. ના ચાલુ એસ.ઓ.આર. મુજબ અથવા તે સમયના બજાર ભાવો તથા કોન્ટ્રાક્ટરે આપેલ રેઈટ એનાલીસીસ અને કોન્ટ્રાક્ટરમાં આવતી તે જાતની આઈટમના ભાવ ઉપરથી નક્કી કરવામાં આવશે. આવી એક્સ્ટ્રા આઈટમ એક્સ્ટ્રા કામોના નગરપાલિકા એ નક્કી કરેલા ભાવ આખરી અને બંને પાર્ટીને બંધનકર્તા રહેશે.

(અ) જ્યારે કોઈપણ કામનો ભાગ સરખી રીતે માપી ન શકાય કે તેની કિંમત અંદાજ ન શકાય ત્યારે કોન્ટ્રાક્ટરને તેનું રેઈટ એનાલીસીસ મુજબની ઉચક કિંમત નગરપાલિકા દ્વારા ચુકવવામાં આવશે.

(૮) સલામતીની વ્યવસ્થા :

કોન્ટ્રાક્ટરે કામ સંતોષકારક રીતે પુર્ણ થાય ત્યાં સુધી બધા માણસો માલસામાન અને પ્રોપર્ટીની સલામતી અને રક્ષક માટેની જરૂરી અને પુરતી વ્યવસ્થા અને ગોઠવણી કરવી પડશે. કોઈપણ કામ માટે નગરપાલિકાએ સોંપેલ માલની લેખિત પહોંચ આપી તેની જાળવણી અને વ્યવસ્થિત ઉપયોગ કરી વધેલ માલની પાછી સોંપણી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

(૯) વિમો :

(અ) ચાલુ કામ દરમ્યાન અને કામ સંપૂર્ણ પુરુ થાય ત્યાં સુધી નગરપાલિકાએ સોંપેલ માલ અને નગરપાલિકાએ પેમેન્ટ કરેલ કોન્ટ્રાક્ટરના માલને કોઈ પણ કારણોને લીધે થતા નુકશાન કે ઘટની જવાબદારી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટરની રહેશે. આ કામ પુરુ થાય માટે ત્યાં સુધીના માલસામાન કામના જોખમે તથા આજુબાજુની માલ મિલ્કતને થાય તેવા નુકશાન માટે નગરપાલિકા સુચવે તેવો વિમો કોન્ટ્રાક્ટરે લેવા પડશે. આવી વિગતની પોલીસી કોઈપણ નેશનલાઈઝડ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી નગરપાલિકાની ફેવરમાં કુલ સમય મર્યાદા તથા ટાઈમ લીમીટનો વધારો કે કામ મોડુ પુરુ થાય ત્યાં સુધી સમયની લેવાની રહેશે તેનું તમામ પ્રિમિયમ કોન્ટ્રાક્ટરે ભોગવવાનું રહેશે.

(બ) આ ઉપરાંત કોન્ટ્રાક્ટર ચાલુ કામ દરમ્યાન કામ કરતા પોતાના માણસો તથા નગરપાલિકાના કોઈ પણ પ્રતિનિધીઓ માટે વર્કમેન કોમ્પનશનબલ ઈન્સ્યોરન્સ કામ પુરુ થાય ત્યાં સુધીના સમય માટે લેવાનાં રહેશે.

(૧૦) ચોકીદાર :

કોન્ટ્રાક્ટરે પોતાના સ્વખર્ચે સાઈટ ઉપર તમામ માલ સામાનની સલામતી જાળવણી કરી શકે તેવા ચોકીદારની વ્યવસ્થા કરવાની રહેશે આવી વ્યવસ્થા માલસામાન તેમજ મજૂરોની સલામતી તેમ માલ સામાનની હેરફેર તથા સ્ટોરેજને કન્ટ્રોલ કરી શકે તેવી પુરતી રાખવાની રહેશે.

(૧૧) સેટીંગ આઉટ :

કોન્ટ્રાક્ટરે પોતે પ્લાન ઉપરથી કામને સેટ આઉટ કરવાનો રહેશે અને સાચા અને ચોકકસ સેટીંગ આઉટ ઉપરાંત દરેક બિલ્ડીંગની પોઝીશન લેવલ માપસાઈઝ તથા એલાઈમેન્ટની ચોકકસાઈની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. કોઈપણ સમયે જો ચાલુ કામ દરમ્યાન તેમાં કોઈ ભુલ જણાશે તો નગરપાલિકાના એન્જનીયરને યોગ્ય લાગે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરે પોતાના સ્વખર્ચે આવી ભુલ સુધારવાની રહેશે.

(૧૨) બ્રાન્ડ (મેઈક) :

જ્યાં જ્યાં કોઈ કામ માટે નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટ કોઈ મટીરીયલ્સ માટે કોઈ ચોકકસ બ્રાન્ડ કે મેઈક દર્શાવેલ હોય ત્યાં કોન્ટ્રાક્ટરે તેજ વસ્તુ વાપરવાની રહેશે. કોન્ટ્રાક્ટર આવી વસ્તુઓની સમકક્ષ બ્રાન્ડ કે મેઈક નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટની પૂર્વ મંજૂરી લીધા પછી વાપરી શકશે અને આવી પૂર્વ મંજૂરી આ ફેરફાર માટેના કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા બધા કારણો લક્ષમાં રાખીને આપવામાં આવશે.

(૧૩) ઝાડ પાન :

નગરપાલિકાએ દર્શાવેલા ઝાડ કે વનસ્પતિને ચાલુ કામ દરમ્યાન નુકશાન ન થાય તે રીતે જાળવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે આવા ઝાડથી ત્રણ ફુટ ત્રિજ્યાની અંદર જમીનનું લેવલ બદલાવી શકાશે નહીં જરૂર જણાય ત્યાં આવી જગ્યાએ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે કામ ચલાઉ ફેન્સીંગની વ્યવસ્થા કરી આપવી પડશે. કામગીરીમાં અડચણ રૂપ ઝાડી-ઝાંખરા દુર કરવી તેમજ આવવા જવવાનો રસ્તો બનાવવાની જવાબદારી ઈજારદારની રહેશે.

(૧૪) ખાદેલી વસ્તુઓ :

સાઈટ ઉપર પડેલ અથવા તો ચાલુ કામ દરમ્યાન ખોદકામમાં મળી આવેલ કોઈપણ ઘાતુ અવશેષ કે કિંમતી વસ્તુઓ જાળવીને બહાર કાઢીને તુરત જ સાચવી રાખીને જે તે સ્થિતિમાં જ સારુ કર્યા વિના નગરપાલિકાને સોંપી દેવાની રહેશે.

(૧૫) નકકી આઈટમ રેઈટ :

આ કોન્ટ્રાક્ટમાં આવતી તમામ આઈટમોના નકકી કરેલ અને બંને પાર્ટીઓએ સ્વિકારેલા ભાવે કામ પુરુ થાય ત્યાં સુધી કાયમ રહેશે તેમજ ભાવ વધારો કે બીજા કોઈપણ કારણોસર કોઈપણ જાતના ફેરફાર આ ભાવોમાં કરી શકાશે નહીં. બેઝીક રેઈટનાં ભાવ ફેર તથા એક્સ્ટ્રા આઈટમ કે એક્સ્ટ્રા કામમાં નગરપાલિકા દ્વારા નકકી કરાવેલ ભાવ ફાઈનલ ગણાશે.

(૧૬) પર્ટ-સી.પી.એમ.પ્લાનીંગ :

કોન્ટ્રાક્ટરે વર્ક ઓર્ડર મળ્યાની ૧૫ દિવસની અંદર પર્ટ-સી.પી.એમ. તૈયાર કરીને કામ ચાલુ કરવાની તથા પુરુ કરવાની સંભવિત તારીખો સાથે કામનાં જુદા જુદા સ્તરોએ બઘી એક્ટીવીટી માટે નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટ પાસે મંજૂર કરેલ પ્રોગ્રામ મુજબ જ કામ કરવાનું રહેશે.

રજા દરમિયાન કે રવિવારે કોઈ પણ પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ રાખી શકાશે નહીં. જો સમયમર્યાદાની અથવા તાત્કાલિક કામ પુર્ણ કરવા જરૂરીયાત પડે તો રજા દરમિયાન કે રવિવારે કામ ચાલુ રાખવા માટે કોન્ટ્રાક્ટરે અગાઉથી મ્યુ.એન્જનીયર/કન્સલ્ટન્ટશ્રીની બે દિવસ અગાઉ લેખિત મંજૂરી લેવી પડશે અને નગરપાલિકાના હાજર રહેનાર સ્ટાફનો ઓવર ટાઈમ મ્યુનીસીપલ નિયમ મુજબ કોન્ટ્રાક્ટર આપવા બંધાયેલ રહેશે.

(૧૭) મશીનરી-સાધનો :

કામ સારી રીતે ચાલુ રહીને પુરુ થઈ શકે તે માટે કોન્ટ્રાક્ટરે નીચે જણાવ્યા મુજબના બઘી જાતનાં જરૂરી અને પુરતા સાધનો-યંત્રો તથા હથીયારો ઓજારો વિગેરે રાખવા પડશે.

જેવાકે ડામર કામ માટે હોટ મીક્ષીંગ પ્લાન્ટ, પેવર મશીનરી, રોડ રોલર, વાઈબ્રેટર રોલર, સ્પ્રેયર, બોઈલર ઈત્યાદી.

મકાન બાંધકામના કામ માટે જરૂરી સેન્ટરીંગ, સ્કેફોલ્ડીંગ, સટરીંગ, મિક્ષર મશીન ઈત્યાદી.

આર.સી.સી. રોડના કામ માટે ડબલ બીમ સ્ક્રીડ વાઈબ્રેટર, સક્શન મેટ ટોપ કવર, ફિલ્ડર પેડ, વેક્યુમ પંપ, પાવર ટ્રોવેલ કમ ફ્લોટર, ગ્રુવ કટર, મિક્ષર મશીન, સાઈડ સપોર્ટ ચેનલ ઈત્યાદી.

માટી કામ, રોડ લેવલીંગ કામ, તળાવ ખોદકામ, ખોદાણ અને પુરાણના કામો માટે જરૂરી જે.સી.બી., પોકલેન, ટ્રેક્ટર, ડમ્પર, ટેન્કર, ડોઝર જેવી જરૂરી મશીનરી સાધનો ઈત્યાદી.

આ મુજબ બાંધકામ તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કામો માટે જોઈતા જરૂરી સાધનો રાખવા પડશે. અન્યથા ઈજારદારશ્રીને કામ શરૂ કરવા દેવામાં આવશે નહીં.

(૧૮) સાઈટ ચોખ્ખી રાખવા બાબત :

સાઈટ ની જગ્યા તથા મજૂરોના રહેઠાણ તથા તેમની કામ કરવાની જગ્યા સારી સ્થિતિમાં રાખવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. સાઈટ પરની બઘી અડચણો પથ્થરો તથા અન્ય મટેરીયલ કચરો કે ઘાસપાન વિગેરે કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે દુર કરી સાઈડ ચોખ્ખી કરવાની રહેશે. કામ પુરુ થયે સાઈડ પરના ખાડાઓ કે છુટા પથ્થરો કાઢવાથી થયેલ ખાડાઓ મુરમથી પુરી બરોબર રોલીંગ કરી સાઈડ ચોખ્ખી કરાવવા માટે કોન્ટ્રાક્ટરને કોઈપણ જાતનું વધારાનું પેમેન્ટ કરવામાં નહીં આવે.

(૧૯) સાઈટ એન્જનીયર :

ચાલુ કામ દરમિયાન કોન્ટ્રાક્ટ આખા દિવસના સમય માટે નગરપાલિકા મંજૂર કરે તેવા અનુભવી અને લાયકાત ધરાવતો એન્જનીયર રાખવાનો રહેશે અને પ્રોજેક્ટ સાઈડ પર જયારે માણસો કામ કરતા હોય ત્યારે તેની પુરી હાજરી રાખવી પડશે. કોન્ટ્રાક્ટરે રાખેલ આવા એન્જનીયરને નગરપાલિકાના એન્જનીયરે આપેલ કોઈપણ સુચના સમજૂતી દોરવણી કે નોટીસ એ કોન્ટ્રાક્ટરને આપ્યા બરાબર ગણાશે.

(૨૦) માણસો છુટા કરવા :

નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટની સુચનાથી કોન્ટ્રાક્ટરે પોતાના કામ ઉપર રાખેલ કોઈપણ માણસો કે જે તેમની દ્રષ્ટિએ ગેરલાયક કે ગેરવર્તણુક કરતો અભ્યાસ લાગશે તેને તુરંત રજા આપની છુટો કરી દેવો પડશે અને નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટ ની લેખિત મંજૂરી વિના આવા છુટા કરેલ માણસને ફરીથી કામે રાખી શકશે નહીં.

(૨૧) પેટા કોન્ટ્રાક્ટર :

આ કોન્ટ્રાક્ટમાં આવતુ તમામ કામ કોન્ટ્રાક્ટરે પોતેજ કરવાનું રહેશે અને નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના આ કોન્ટ્રાક્ટરનું તમામ કામ તે તેનો અમુક ભાગ સીધી કે આડકતરી રીતે બીજો કોઈ પણ કોન્ટ્રાક્ટરને ટ્રાન્સફર કે પેટા કોન્ટ્રાક્ટ કે કમીશનથી આપી શકશે નહીં અને આવી મંજૂર છતાય ચાલુ કામ દરમ્યાન કે ગેરંટી પીરીયડ દરમ્યાન કે કોન્ટ્રાક્ટની અંદર આવતી તમામ અને સંપૂર્ણ જવાબદારી મેઈન કોન્ટ્રાક્ટરની રહેશે.

(૨૨) બાયલોઝ ધારાધોરણ :

આ કામને લાગુ પડતા ધારાધોરણી તમામ જોગવાઈઓ કોન્ટ્રાક્ટરે પુરી પાડવાની રહેશે અને રસ્તા, પાણી, લાઈટ અથવા અન્ય વસ્તુઓ માટેના નિતિ નિયમો તથા બાયલોઝનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. કોન્ટ્રાક્ટરે આવી જુદી જુદી ઓથોરીટીના નિયમો અને બાયલોઝની જોગવાઈઓ અને પુરી કરવાની પધ્ધતિઓ નગરપાલિકાના ધ્યાન પર લાવવાની રહેશે.

નગરપાલિકા તરફથી જગ્યા ઉપર નક્કી કરેલા લેવલ મુજબ કોન્ટ્રાક્ટરે રસ્તો કેમ્બરમાં બનાવવાનો છે અને વરસાદી પાણી ભરાય નહીં તે મુજબનો દરેક જગ્યાએ ઢાળ આપીને પાણીનો નિકાલ થાય તે મુજબનો રસ્તો બનાવવાની છે. આ બાબતની જરૂરી માહિતી તેઓએ નગરપાલિકામાંથી મેળવવાની છે.

(૨૩) વધારાનો માલ સામાન :

કામ સંપૂર્ણપણે પુરુ થયા પછી વધારાનો માલસામાન નગરપાલિકાની મંજૂરી પછી કોન્ટ્રાક્ટરને સાઈટ પરથી લઈ જવા દેવામાં આવશે.

(૨૪) પેમેન્ટ હકો :

કોન્ટ્રાક્ટરે સખ્લાય કરેલ માલ કે કોન્ટ્રાક્ટરે કોઈપણ કામને કારણે ઉભા થતા પેમેન્ટ હકો રોયલ્ટી, લાયસન્સ ફી, નુકશાન, ખર્ચ કે વળતરનાં દાવાઓની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની પોતાની રહેશે. આ કામ માટે વપરાશમાં આવતો માલસામાન સિમેન્ટ, કપચી, મેટલ, મોરમ, રેતી, લોખંડ, હાથફોડ મેટલ, ઈટ, આર.સી.સી. એન.પી-૨ કલાસપાઈપ એસ્ફાલ્ટની રોયલ્ટી, ફી તથા અન્ય તમામ જાતનાં સરકારી ટેક્ષ વિગેરે કોન્ટ્રાક્ટરે ભરવાનાં રહેશે.

(૨૫) સાઈટ મીટીંગ :

કામની વ્યવસ્થીત પ્રોગ્રેસ કે કામ દરમ્યાન ઉભા થયેલ પ્રશ્નોની વિચારણા માટે અથવા તો કામના સંકલન માટે નગરપાલિકાના એન્જીનીયરે બોલાવેલ સમયે વખતો વખતની સાઈટ મીટીંગમાં હાજર રહેવું પડશે.

(૨૬) બાળ મજૂરો :

કોન્ટ્રાક્ટરે ૧૪ વર્ષની નીચેના બાળ મજૂરોને કામ પર રાખવા નહીં. જો સ્ત્રી મજૂરો, કામ ઉપર હોય તો કોન્ટ્રાક્ટરે નાના બાળકોના રક્ષણ માટે તથા કામના સ્થળથી તેમને દુર રાખવાની તમામ વ્યવસ્થા કરવાની રહેશે. નગરપાલિકાને લેખિત મંજૂરી સિવાય કોન્ટ્રાક્ટરના માન્ય ચોકીદાર સિવાય બીજા કોઈપણ મજૂરોને કમ્પાઉન્ડમાં રહેવા દેવામાં આવશે નહીં.

(૨૭) માલસામાનનો બગાડ :

જયારે પણ કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા કોઈપણ મટીરીયલ્સ વાપરવા દેવામાં આવે જેવાકે લોખંડ, સિમેન્ટ, સિમેન્ટ શીટ્સ ત્યારે કોન્ટ્રાક્ટરને ડ્રોઈંગ તથા સ્પેશીફિકેશન ઉપરથી ગણતરી કરેલ જથ્થા પરથી ૫% વેસ્ટેજ ગણીને વાપરવા દેવામાં આવશે. જો નગરપાલિકાને આના કરતા વધુ વપરાશ થયેલો જણાશે તો બેઝીક રેઈટના ડબલ રેઈટથી વધારાના જથ્થાની કિંમત વસુલ કરાશે અથવા તો તે આઈટમના ટેન્ડર ભાવ મુજબની રકમ બે માથી જે વધુ હશે તે વસુલ કરાશે.

(૨૮) ઈન્સ્પેક્શન :

કોન્ટ્રાક્ટમાં આવતું કોઈ પણ જાતનું ચાલુ કામ અથવા થઈ ગયેલું કામ કોઈપણ સમયે નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટશ્રી તપાસી શકશે તે રીતે ખુલ્લુ રાખવું પડશે. આવી દરેક વિઝીટ વખતે કોન્ટ્રાક્ટરે તપાસ થઈ શકે અને માપ સાઈઝ લઈ શકાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા અને માણસોની મદદ કરવી પડશે.

જે કામનો ભાગ માપ લેવા માટે ઢંકાઈ જતો હોય તો તે ઢંકતા પહેલા ઓછામાં ઓછા પાંચ દિવસ પહેલાં કોન્ટ્રાક્ટરે નગરપાલિકા એન્જનીયર / કન્સલ્ટન્ટને અથવા તેમના માણસને ખબર આપવી પડશે અને તેવી ખબર નહીં આપી હોય તો માપ લેવા માટે કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચ ઢંકેલો ભાગ ખુલ્લો કરી આપવા પડશે, ભાગ ઢંકતા પહેલા સબઓર્ડિનેટની પરવાનગી લેવી ખાસ જરૂરી છે.

(૨૯) અન્ય કોન્ટ્રાક્ટરો :

આ કોન્ટ્રાક્ટનું કોઈપણ કામ આપવું અથવા તો તેનો કોઈ ભાગ અથવા તો બીજા કામ કે બીજા આઈટમનું કામ કરવા માટે અન્ય કોન્ટ્રાક્ટર રાખવાનો નગરપાલિકાનો અબાદિત હક રહેશે. કોન્ટ્રાક્ટરે આવા બીજા કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવાથી પુરું કરવા સુધી. સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.

(૩૦) કામનો વિલંબ :

નગરપાલિકાને કોન્ટ્રાક્ટમાં આવતું કોઈપણ કામ અથવા તો તેનો કોઈભાગનું કામ કરવામાં વિલંબ કરવાની સુચના આપવાનો અધિકાર રહેશે. જો આવો વિલંબ કોન્ટ્રાક્ટરના કોઈપણ જાતના કારણ વગર કરવામાં આવશે તો નગરપાલિકાના નિર્ણય મુજબ સમય મર્યાદામાં તેટલો વધારો કરી આપવામાં આવશે.

(૩૧) ક્ષતિવાળા કામોનો નિકાલ :

જો નગરપાલિકા એન્જનીયરને કોઈ કામ અથવા તેનો ભાગ સ્પેશીફિકેશન મુજબના મટીરીયલ્સ થી ન થયેલો અથવા તો બરાબર કારીગરી વાળો ન જણાશે તો સમયે સમયે લેખિત હુકમ આપીને હુકમમાં દર્શાવેલ સમય મર્યાદામાં આવું કામ કઢાવી નાંખવાનો અધિકાર રહેશે. કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે આવું કામ કઢાવવું પડશે અને તેની જગ્યાએ નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટની સુચના મુજબ નવા મટીરીયલ્સથી સારું કામ ફરીથી વિનામુલ્યે કરી આપવાનું રહેશે. જો કોન્ટ્રાક્ટર આવા હુકમનું પાલન કરવાનો અનાદર કરશે તો નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટ આ કામ દુર કરી નવું કામ કરાવવા માટે બીજા માણસો અથવા સબ કોન્ટ્રાક્ટર આપવાનો અધિકાર રહેશે. આ કામ પાછળ થતો બધો ખર્ચ નગરપાલિકા પાસે કોન્ટ્રાક્ટરની જમા પડેલ રકમ, જમા થવાની રકમમાંથી ચુકવી આપશે.

(૩૨) પેમેન્ટ અટકાવવું :

દીમી ગતીએ ચાલતું કામ અથવા તો બરાબ કામગીરી વાળું કામ અથવા તો નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટની વખતો વખતની સુચનાઓનું પાલન કોન્ટ્રાક્ટર ન કરે અથવા તો અન્ય કોઈ પણ દર્શનીક કારણે ને લઈને નગરપાલિકા કોન્ટ્રાક્ટરને કરવાનું પેમેન્ટ અટકાવી શકશે અને જ્યાં સુધી

નગરપાલિકાને પેમેન્ટ અટકાવવાની જરૂરીયાત માટેના કોઈ કારણ રહ્યાની ખાત્રી થાય ત્યાં સુધી આવું પેમેન્ટ અટકાવી શકશે. આ કોન્ટ્રાક્ટરને લગતા કોઈ કામ બાબતે કે કોન્ટ્રાક્ટરે કરવાની વસ્તુ કરવાથી કે કરવાનું મોકુફ રાખવાથી નગરપાલિકા વિરુદ્ધ થયેલ કે કોઈપણ દાવા, કેસ, માંગણી કે પગલાથી અથવા તો આ કોન્ટ્રાક્ટરને લગતા કામો કરવાથી કે કરવાનું મોકુફ રાખવાથી કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કરેલ દાવો કે પગલા થી નગરપાલિકાને થતા નુકશાન કે ખોટની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે અને નગરપાલિકાને આવા દાવા કે કેસમાં રક્ષણ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

કોન્ટ્રાક્ટર, નગરપાલિકા સામે પેમેન્ટ બાબતે કોર્ટમાં કોઈ પણ પ્રકારનો દાવો કરી શકશે નહીં અને દાવો નગરપાલિકા તરફથી માન્ય રાખવામાં આવશે નહીં.

(૩૩) મોડીફિકેશન :

આ કોન્ટ્રાક્ટની કોઈપણ શરતો કે જોગવાઈઓ ફેરફાર કરવાની જરૂર જણાય તો આવા ફેરફાર લેખિતમાં કરવાની રહેશે એમા બંને પાર્ટીઓએ સહી કરીને કરવાનો રહેશે અને આ ન થાય ફેરફારવાળું કોઈપણ કામ કરવા દેવામાં આવશે નહીં. સમગ્ર કોન્ટ્રાક્ટ અથવા તો તેની કોઈપણ શરતો રદ કરતો વધારો કરેલ કે પરક કોઈપણ જાતનો મૌખિક કે લેખિત હુકમની જવાબદારી જ્યાં સુધી તેમાં નગરપાલિકાની સહી ન થાય ત્યાં સુધી નગરપાલિકાની રહેશે નહીં અને ત્યાં સુધીના આવા હુકમો રદ કરી શકાશે. આવીજ રીતે નગરપાલિકાના એન્જનીયર / કન્સલ્ટન્ટને લેખિત ઓર્ડર આપીઆ કોન્ટ્રાક્ટ માટેનું કોઈપણ કામ વધારાવાનો વિસ્તારવાનો ઓછું કરાવવાના તથા ડિઝાઈન, સાઈઝ, જથ્થો, માપ કે મટીરીયલનો ઉપયોગનો ફેરફાર કે બદલવાનો તથા કોઈ વધારાનું કામ લેખિત હુકમથી કરવાનો કે કોઈ ન કરવાનો અધિકાર છે. આવા વધારાના ખરેખર થયેલ કામ તથા વપરાયેલ મટીરીયલ્સ પ્રમાણે પેમેન્ટ કરવામાં આવશે. કોઈપણ જાતના વિસ્તરણ સંકોચન વધારો કે ઘટાડો કે ફેરફારને કારણે આ કોન્ટ્રાક્ટરની કાયદેસરતાને કોઈ અસર થશે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરે આવા કામો કોન્ટ્રાક્ટ માટેના જગણી કોન્ટ્રાક્ટની દરેક શરતો લાગુ પાડીને સ્પેસીફિકેશન મુજબ જ કરવાના રહેશે આવા કામનાં વિસ્તરણ ઉમેરો સંકોચન ઘટાડો ફેરફાર કે સુધારા વધારાના સમયે નગરપાલિકાના એન્જનીયરના નિર્ણય મુજબ ટેન્ડરની આઈટમના રેઈટ ઉપરથી નવા રેઈટ નક્કી કરી પેમેન્ટ કરવાનું રહેશે.

(૩૪) કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કરવા માટે :

કોઈપણ સમયે જો નગરપાલિકાના એન્જનીયરને એવું જણાશે કે કોન્ટ્રાક્ટરને આપેલ કામ યોગ્ય સમયે શરુ નથી થયું અથવા તો કોન્ટ્રાક્ટરે લાવેલ માલ મટીરીયલ્સ અથવા તો તેની વર્કમેનશીપ સંતોષકારક નથી તો નગરપાલિકાને આ કોન્ટ્રાક્ટ ૭-દિવસની લેખિત નોટીસ આપીને ટર્મીનેટ કરવાનો અધિકાર છે અને બાકીનું કામ અન્ય કોન્ટ્રાક્ટર પાસે મુળ કોન્ટ્રાક્ટરના જોખમે અને જવાબદારીએ પુરુ કરવાનો અધિકાર છે. આવી બાબતોમાં નગરપાલિકાનાં નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે. તદ્દુપરાંત કામ શરુ કર્યા પછી કોઈપણ સમયે કોઈપણ કારણોસર જો નગરપાલિકાને કોન્ટ્રાક્ટમાં દર્શાવેલ સમગ્ર કામ અથવા તો તેના કોઈભાગ કરવાની જરુર ન લાગે કે ઈચ્છા ન થાય તો નગરપાલિકા કોન્ટ્રાક્ટરને લેખિત નોટીસ આપીને કામ બંધ કરાવી શકશે. જો નગરપાલિકા ધ્વારા કોન્ટ્રેક્ટ ટર્મીનેટ કરવામાં આવે અથવા તો સમગ્ર કામ કે તેનો કોઈભાગ કેન્સલ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરને સમગ્ર કામ પુર્ણ થયે થવો જોઈતો નફો કે લાભ કે આવું કામ ન કરવાથી ન થયું તે બાબતનું કોઈ પણ જાતનું વળતર કે ચુકવણું આપવામાં આવશે નહીં. આમ છતાં તે કોન્ટ્રાક્ટરે કરેલા ખરેખર કામનાં માપ મુજબ નક્કી કરેલા ભાવ પ્રમાણેનું પેમેન્ટ કરી આપવામાં આવશે.

એક કરતા વધુ કામોનાં કેસમાં દરેક કામ એકસાથે ચાલુ થાય તેવું આયોજન ઈજારદારશ્રીએ ગોઠવવાનું રહેશે. આ આયોજન કે ગોઠવણી માટે ઈજારદારશ્રીને કોઈ મોબીલાઈઝેશન ચાર્જ ચુકવવામાં આવશે નહીં, કોઈ સંજોગોમાં એવું જણાશે કે ઈજારદારશ્રી કામનાં ભારણને પહોંચી શકે તેમ નથી, તેવા પ્રસંગોમાં નગરપાલિકા ધ્વારા કોન્ટ્રાક્ટરની શરતોનું પાલન ન થવા બદલ તેમનું કામ રદ કરશે અને

સિક્યુરીટી ડિપોઝીટ જપ્ત કરશે. આ કામ અન્ય ઈજારદારને સોંપી શકશે અને જે વધારાનો ખર્ચ થાય તે કોન્ટ્રાક્ટર પાસેથી વસુલ કરવાનો રહેશે.

(૩૫) કંપલીશન સર્ટીફિકેટ :

કામ પુરુ થયા પછીથી નગરપાલિકા એન્જનીયર / કન્સ્ટ્રક્ટ તરફથી કંપલીશન સર્ટીફિકેટ આપવામાં આવશે. કંપલીશન સર્ટીફિકેટ આપતા પહેલા કોન્ટ્રાક્ટરનું કામ સંપૂર્ણ રીતે પુરુ થયેલું હોવું જોઈએ. તેમજ સાઈટ સંપૂર્ણ ચોખ્ખી હોવી જોઈએ. જો કોઈપણ જાતની કામમાં ખામી રહી ગઈ હશે તો કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચ રહેલ ખામી રીપેર કરી આપવાની તેમજ સાઈટ પર પડી રહેલ માલસામાન પોતાની જાતે દુર કરી આપવાનાં રહેશે. ત્યારબાદ જે કામગીરી પુર્ણ થયાનું સર્ટીફિકેટ નગરપાલિકા તરફથી આપવામાં આવશે.

(૩૬) લવાદી :

કોઈપણ કારણસર નગરપાલિકા એન્જનીયર / કન્સ્ટ્રક્ટ અથવા તેના પ્રતિનિધિ સાથે કોન્ટ્રાક્ટરને મતભેદ પડે તો તેવા સંજોગોમાં નગરપાલિકાનો નિર્ણય છેવટનો ગણાશે અને તે કોન્ટ્રાક્ટરને તથા નગરપાલિકાને બંધનકર્તા રહેશે.

આ કોન્ટ્રાક્ટમાં આવરી લેવાયેલ સ્પેસીફિકેશન ટેન્ડરની જનરલ શરતો અથવા તો આમાં કરાયેલ સુધારા, વધારા કે ફેરફાર માટે અથવા તો કોઈ પણ બાબતે ઉભા થયેલા પ્રશ્નો વાંધાઓ કે મતભેદો પ્રમુખશ્રી નગરપાલિકા અથવા તો તેમણે નક્કી કરેલ કોઈ પણ વ્યક્તિનો લવાદી ધ્વારા નિકાલ કરવાનો રહેશે. આ લવાદી ઈન્ડિયન આર્બિટ્રેશન એક્ટ ૧૯૪૦ પ્રમાણે આર્કીટેક્ટ સુચવે તે સ્થળે કરાશે અને આવા લવાદનો ચુકાદો અને કોન્ટ્રાક્ટની બંને પાર્ટીઓને બંધનકર્તા રહેશે.

(૩૭) જયુરીડીકશન :

નગરપાલિકાની હેડ ઓફિસ જે શહેરમાં હોય તે સ્થળે આ કોન્ટ્રાક્ટ થયેલ ગણાશે અને તે શહેરની કોર્ટમાં જ બંને પાર્ટી વચ્ચેના વાંધા કે તકરારનો નિકાલ કરવાનો રહેશે.

ઉપરોક્ત તમામ ૧ થી ૩૭ કોન્ટ્રાક્ટની શરતો મે વાંચેલ છે અને જે મને બંધનકર્તા રહેશે. જે બદલ નીચે સહી કરી આપેલ છે.

કોન્ટ્રાક્ટરની સહી	ચીફ ઓફિસર	પ્રમુખ
(નામ :)	નગરપાલિકા સોનગઢ	નગરપાલિકા સોનગઢ

નગરપાલિકા સોનગઢ

:: કોન્ટ્રાક્ટની ખાસ શરતો ::

- (૧) આ ટેન્ડર આઈટમ રેઈટ બેઈઝ / ટકાવારી રેઈટ બેઈઝ પર માંગવામાં આવેલ છે. શેડયુલ આઈટમ સામે કોન્ટ્રાક્ટરે પોતાના ભાવ આંકડામાં તેમજ શબ્દોમાં ભરી કુલ સરવાળો કરવાનો રહેશે. / શેડયુલ આઈટમના સરવાળા પર કોન્ટ્રાક્ટરે ટકાવારી મુજબ અંદાજિત કિંમતથી ઉચા-નીચા ભાવ ભરવાના રહેશે.
- (૨) તમામ કામગીરી માર્ગ અને મકાન વિભાગના જનરલ ટેકનીકલ સ્પેશીફિકેશન મુજબ કરવાની રહેશે. તેમજ કામમાં વાપરવાના થતા દરેક મટીરીયલ્સ જેવાકે, સીમેન્ટ, રેતી, કપચી વગેરે તમામ પ્રકારની મટીરીયલ્સ નગરપાલિકા પાસે એપ્રુવલ કરાવ્યા બાદ જ સપ્લાય કરવાનાં રહેશે. એપ્રુવલ મેળવ્યા વગર સપ્લાય કરેલ કોઈપણ મટીરીયલ્સ સપ્લાય કરવામાં આવશે કે વાપરવામાં આવશે તો તેનું ચુકવણું કરવામાં નહીં આવે અને તેવા મટીરીયલ્સ પરત લઈ જવાની જવાબદારી એજન્સીની પોતાની રહેશે. ટેન્ડરમાં કોઈ આઈટમ સ્પેશીફિકેશન આપવામાં આવેલ ન હોય, તેવા સંજોગોમાં નગરપાલિકા દ્વારા જે સ્પેશીફાય કરવામાં આવે તે માન્ય રાખવાનું રહેશે.
- (૩) સદરહું કામમાં વપરાતા દરેક મટીરીયલ્સના તેમજ કબુના ટેસ્ટીંગ નિયમોનુસાર ‘ગેરી’ અથવા સરકાર માન્ય લેબોરેટરીમાં એજન્સીએ પોતાના ખર્ચે ટેસ્ટીંગ કરાવી રીપોર્ટ નગરપાલિકામાં રજૂ કરવાના રહેશે અને જ્યારે એજન્સી દ્વારા ટેસ્ટીંગ રીપોર્ટ કરવામાં નહીં આવે ત્યારે કામના થતા રનીંગ/ફાઈન બિલમાંથી ૧.૦૦% મુજબ થતો ચાર્જ કપાત કરવામાં આવશે અને ટેસ્ટીંગનાં રીપોર્ટ ૧૦% મુજબના ગેરીના અને ૯૦% મુજબના સરકાર માન્ય લેબોરેટરીનાં રજૂ કરવાના રહેશે.
- (૪) કામના થતા બિલમાંથી પ્રવર્તમાન દર મુજબ ઈન્કમેટેક્સ કપાત કરવામાં આવશે તથા ૨.૫૦% મુજબ સિક્યોરીટી ડીપોઝીટ તથા ૧% મુજબ વેલ્ફેર ફંડ કપાત કરવામાં આવશે. કામ મંજૂર થયેલ ૨.૫૦% મુજબ ડિપોઝીટ ભરવાની રહેશે. ભરેલ તથા કપાત કરેલ કુલ ૫.૦૦% સિક્યોરીટી ડિપોઝીટ કામ પુર્ણ થયે કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યેથી ત્રણ વર્ષ સુધી સોનગઢ નગરપાલિકામાં જમા કરવાની રહેશે અને ટેન્ડર મંજૂર થયેથી ૫.૦૦% મુજબ પરફોર્મન્સ બોન્ડ ડીપોઝીટ એફ.ડી.આર. / બેંક ગેરન્ટી રૂપે જમા કરવાની રહેશે. જે રકમ સંપુર્ણ કામ પુર્ણ થાય અને ફાઈનલ બિલના પેમેન્ટ થયા બાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યા બાદ છુટી કરવામાં આવશે અને ૦.૭૫% મુજબ TPI ચાર્જ રનીંગ/ફાઈનલ બિલમાંથી કપાત કરવામાં આવશે.
- (૫) આ કામ માટે એજન્સી દ્વારા સિક્યોરીટી ડીપોઝીટ પેટે જો એફ.ડી.આર. નેશનલાઈઝ બેંકની રજૂ કરવામાં આવે તો કરાર આ કામની અંદાજિત કિંમતના ૫% મુજબ આવતી રકમના ૪.૨૫% મુજબ સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે જ્યારે એજન્સી દ્વારા સિક્યોરીટી ડિપોઝીટ પેટે બેંક ગેરન્ટી સરકાર માન્ય બેંકની રજૂ કરવામાં આવશે તો કરાર રૂ. ૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવાનાં રહેશે.
- (૬) ખોદાણકામ દરમ્યાન ટેલીફોનના કેબલ, ઈલેક્ટ્રીક કેબલ, નગરપાલિકાની પાણીની પાઈપ લાઈનો, ગટર લાઈન તેમજ અન્ય કોઈપણ ઈસમોની માલમત્તાની નુકશાની ઈજારદારે સ્વખર્ચે ભોગવવાની રહેશે અને તે અંગેના લીગલ બાબતની જવાબદારી ઈજારદારના શીરે રહેશે.

- (૭) આ કામ કરતા કોઈપણ મજૂર, કારીગર, સુપરવાઈઝર કે અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા તો મૃત્યુ પામે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આ અંગેની અકસ્માત વીમા પોલીસ લેવાની જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.
- (૮) જો નગરપાલિકા તરફથી આર.એમ.સી. દ્વારા કરાવવામાં આવશે તો, આર.સી.સી. રોડનું કામ ટ્રી-મીક્સ પદ્ધતિથી અને ૩૦ ઘ.મી. કેપેસિટી બેચીંગ પ્લાન્ટ ટ્રાન્ઝીટ મીક્સ ડ્રમવાળી ગાડીથી સાઈટ પર માલ વપરાશ કરવાનું, મીનીમમ ચાર TM વપરાશ કરવાના રહેશે. તેમજ M200 માં સી.સી.વર્ક, મિક્સ ડીઝાઈન ૮.૪૦ પર ઘ.મી. IS કોડ મુજબ કરાવી, કરાવવાનું રહેશે.
- (૯) આર.સી.સી. ફ્લોરીંગમાં કોંક્રીટ થયા બાદ ગ્રુવ કટરથી ગ્રુવ બનાવી ડામર શીટ મુકવાની રહેશે તેમજ ફરજિયાત પંદર દિવસ સુધી કોંક્રીટ રોડ ઉપર કચારા બનાવી કચોરીંગ કરવાનું રહેશે. આ વિગત જાણી એજન્સીએ ભાવ ભરવાનાં રહેશે.
- (૧૦) પેવર બ્લોક ફીટીંગના કામ થયા બાદ તેની ઉપર તુરંત વાઈબ્રેટર દ્વારા ફરજિયાત વાઈબ્રેટીંગ કરાવવાનું રહેશે.
- (૧૧) આર.એમ.સી. પ્લાન્ટ માટે એજન્સી પાસે પોતાની ગાડી માલિકીની હોવાના આધાર પુરાવા આપવાનાં રહેશે અથવા આર.એમ.સી. પ્લાન્ટ સાથે એમ.ઓ.યુ. કરવાનું રહેશે અને એજન્સીએ આર.એમ.સી. પ્લાન્ટ સોનગઢ નગરપાલિકાના હદ વિસ્તારમાં નાંખવાનાં રહેશે.
- (૧૨) ટેન્ડરમાં શેડ્યુલ-બીમાં એમ-૨૦૦ ની રેડીમીક્સ આઈટમમાં કોંક્રીટમાં મેલાઈમાઈન બેઈઝ/નેપ્થેલિન બેઝીક કેમીકલ ૧.૫૦ કિ.ગ્રા. પ્રતિ સિમેન્ટ બેગે વાપરવાનું રહેશે. આ વિગત જાણ એજન્સીએ ભાવ ભરવાનાં રહેશે.
- (૧૩) સિમેન્ટ અને સ્ટીલનાં રજીસ્ટર અલગથી રજીસ્ટર નિભાવવાનાં રહેશે તથા પ્રત્યેક રનીંગ બીલ સાથે સિમેન્ટ અને સ્ટીલના પાકા બીલો રજૂ કરવાના રહેશે.
- (૧૪) સોનગઢ નગરપાલિકાના એન્જનીયર/કન્સલ્ટન્ટની સુચના મુજબની કંપનીવાળી સિમેન્ટ બેગ વપરાશ કરવાની રહેશે. તેમજ જે કંપનીનું સ્ટીલ વપરાશની સુચના આપે તે જ કંપનીનું સ્ટીલ વપરાશ કરવાનું રહેશે. આ બાબતે કોઈ તકરાર કરવાની રહેશે નહીં.
- (૧૫) કામગીરીના રનીંગ બીલ કે ફાઈનલ બીલના મેન્ડરમેન્ટ સાથેના એબસ્ટ્રેક્ટ શીટ સાથેના બીલ તૈયાર કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે અને તેની ચકાસણી ન.પા.ઈ./કન્સલ્ટન્ટ સોનગઢ નગરપાલિકા કરી શકશે પરંતુ માપ અંગેની સઘળી જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.
- (૧૬) દરેક રનીંગ/ફાઈનલ બીલના માપો કોન્ટ્રાક્ટરશ્રીએ સોનગઢ નગરપાલિકામાં રજૂ કરવાનાં રહેશે. કોન્ટ્રાક્ટરશ્રીએ પણ જાણકારી ધરાવતા હોવા જોઈએ કે ખોટા માપો સબમીટ કરવા તથા તેના બીલ સોનગઢ નગરપાલિકામાંથી લેવા/ચુકવવા તે એક પ્રકારની આર્થિક ઉચાપત ગણાશે અને તે બદલ ફોજદારી ધારા હેઠળ ફરીયાદ કોન્ટ્રાક્ટરશ્રી પર કરવામાં આવે તો તે અંગેની સઘળી જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.
- (૧૭) કામ પુર્ણ થયા બાદ ભવિષ્યમાં પુર્ણ થયેલ કામ બાબતે આર્થિક રકમની રીકવરીના પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગેની સઘળી જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે અને આર્થિક રીકવરીની રકમ રેવન્યુ રાહે સોનગઢ નગરપાલિકા વસુલી શકશે.

- (૧૮) સિમેન્ટ વપરાશની આઈટમની બાબતમાં ઓછામાં ઓછું ૧૫ દિવસ સુધી વોટર ક્યોરીંગ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે. જો ઈજારદારશ્રી દ્વારા સદર બાબતે ચુક કરવામાં આવશે તો બીલમાંથી ક્યોરીંગ પેટે બીલ કપાત કરી પાર્ટ રેઈટ ચુકવવામાં આવશે.
- (૧૯) જો સોનગઢ નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવે તો પાણીની વપરાશની આઈટમની કિંમતના ૧% મુજબ વોટર ચાર્જ કપાત કરવામાં આવશે.
- (૨૦) તમામ કામગીરી સોનગઢ નગરપાલિકાના અધિકૃત સુપરવાઈઝર/કન્સલ્ટન્ટના અધિકૃત સુપરવાઈઝરશ્રી અથવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની એજન્સીનાં અધિકૃત સુપરવાઈઝરશ્રી/એન્જીનીયરશ્રીની હાજરીમાં જ તમામ કામગીરી કરવાની રહેશે. સુપરવીઝન/સુપરવાઈઝર વગર કરે કામનું પેમેન્ટ ચુકવવા પાત્ર થશે નહીં.
- (૨૧) બીલ રજૂ કરવા બાબત : ઈજારદારશ્રીએ કરેલ બધા કામ માટે જે તારીખે બીલ રજૂ કરવાનું રહેશે તેના અગાઉ કામની ખરાઈ કરવાના ઉદ્દેશથી સંબંધિત કન્સલ્ટીંગ ઈજનેર વખતો વખત જરૂરી માપ તેમજ લેવલ ઈજારદારશ્રી પાસેથી લેવડાવશે. મંજૂર થયેલ ટેન્ડર મુજબ કોન્ટ્રાક્ટરશ્રી એ ઓછામાં ઓછું ૫૦% સુધી નાં કામ પૂર્ણ કર્યા બાદ જ નગર સેવા સદન તરફથી કન્સલ્ટીંગ ઈજનેર મારફત રનીંગ બીલ બનાવડાવી બીલ નું ચુકવણું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીલ રજૂ થયા બાદ ગ્રાન્ટ / લોન ઉપલબ્ધ થયે તેનું ચુકવણું કરવામાં આવશે. ખમ થયા બાદ તેના બીલનું ચુકવણું વિલંબથી થાય તે અંગે કોઈ વ્યાજ ચુકવવા પાત્ર બનશે નહીં.
- (૨૨) રસ્તાની કામગીરીની દરેક સાઈટ પર નિયત લખાણ સાથેના, વિગતો સાથેના બોર્ડ સાઈટ પર મુકવાનાં રહેશે. સાઈટ પર સલામતી સુચક બોર્ડ, નિયત રીબીન, અન્ય આડશ મુકવા વિગેરે અંગેની સઘળી જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે. તેમ છતાં અકસ્માત થાય કે પોલીસ ફરીયાદના પ્રસંગમાં સોનગઢ નગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં. રસ્તાના કામ દરમ્યાન બાયપાસ રસ્તા અંગેની જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.
- (૨૩) માટી કામ (ખોદાણ, પુરાણ, લેવલીંગ) શરૂ કરતા પહેલા ઈજારદારશ્રી દ્વારા ફરજિયાત જે તે સાઈટનું કંટુર સર્વે કરી લેવલ લેવાનાં રહેશે તથા કામ પુર્ણ થયા બાદનું ફાઈનલ માટી લેવલ પણ લેવાના રહેશે. જેના માટે ઈજારદારશ્રી બંધનકર્તા રહેશે. ત્યાર બાદ જ બીલ બનાવી ચુકવણું કરવામાં આવશે.
- (૨૪) કામ શરૂ કરતા પહેલા, ચાલુ કામ દરમ્યાન તેમજ પુર્ણ થયેલ કામના ફોટોગ્રાફ્સ લેવાના રહેશે અને વખતો વખતની ફોટોગ્રાફી ઈજારદારશ્રીએ તેમનાં ખર્ચે કરવાની રહેશે. સ્ટીલના વપરાશના ફોટોગ્રાફ્સ ખાસ અલગથી રજૂ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.
- (૨૫) નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની અધિકૃત સુપરવાઈઝરશ્રી/એન્જીનીયરશ્રીને સાઈટ પર એ મુજબ જણાય કે કામમાં માલ-સામાનમાં સ્પેશીફિકેશન વિરુદ્ધ કંઈક થઈ રહેલ છે તે સંજોગોમાં ચાલુ કામ તાત્કાલિક અસરથી બંધ કરાવી શકશે આ અંગે કોઈ વિવાદ કરવાના રહેશે નહીં.
- (૨૬) કોંક્રીટ કે મોટર બનાવવામાં વપરાશમાં લેનાર રેતી, કપચી/મેટલ માટે તગારા ઉપયોગમાં લઈ શકાશે નહીં તેને બદલે નિયત માપ સાઈઝના હેન્ડલવાળા બોક્ષના ઉપયોગ કરવાનાં રહેશે. અથવા વેબેયર પ્લાન્ટના વજન મુજબ રેતી, કાંકરી કે કપચી વપરાશ કરવાનાં રહેશે.

- (૨૭) આ કામગીરીમાં ખોદાણ દરમ્યાન હયાત ભુગર્ભ ગટરની પાઈપ લાઈન, મેનહોલ ચેમ્બર, હાઉસ કનેક્શન ચેમ્બર, ગટરની હાઉસ કનેક્શનની પાઈપ લાઈન, પાણીની હાઉસ કનેક્શનની પાઈપ લાઈન, પાણીની પાઈપ લાઈન, ઈલેક્ટ્રીક લાઈન, ટેલીફોન લાઈન વગેરે નુકશાન કે નાશ થાય તે સમગ્ર કામગીરી એજન્સીએ (કોન્ટ્રાક્ટરે) માલ સામાન તથા મજૂરી સહિત રીપેરીંગ કરી વ્યવસ્થિત કરી આપવાનું રહેશે. એજન્સીએ જેની ખાસ નોંધ લેવાની રહેશે અને આ વિગત ધ્યાને લઈ એજન્સીએ ભાવ ભરવાનાં રહેશે.
- (૨૮) સી.સી.રોડની કામગીરી દરમ્યાન બન્ને બાજુ હયાત ઓટા કે અન્ય પાકા બાંધકામ તોડવાના થાય તો તેના ભાવ એજન્સી દ્વારા ભરેલ શેડયુલ-બી માં બોક્સ કર્ટીંગની આઈટમ મુજબ ચુકવવામાં આવશે. એજન્સીએ જેની ખાસ નોંધ લેવાની રહેશે અને આ વિગત ધ્યાને લઈ એજન્સીએ ભાવ ભરવાનાં રહેશે.
- (૨૯) સદરહું કામમાં મંજૂર થયેલ ટેન્ડરની કિંમત મુજબ ડીપોઝીટ ભરીને એગ્રીમેન્ટ કરવામાં આવશે. પરંતુ ગ્રાંટની ઉપલબ્ધતા મુજબ વર્ક ઓર્ડર આપવામાં આવશે. તદ્દુપરાંત આ ટેન્ડરની કિંમત મુજબનું કામ કરાવવું કે તેનાથી ઓછી કિંમતનું કામ કરાવવું તે ગ્રાંટની ઉપલબ્ધતા મુજબ હોય જેથી નગરપાલિકા તરફ થી જે નિર્ણય કરવામાં આવશે તે એજન્સી (કોન્ટ્રાક્ટરશ્રી) તે માન્ય રાખવાનો રહેશે. આ બાબતે એજન્સીએ વિવાદ કે કોર્ટ કચેરીમાં જઈ શકશે નહીં તે ધ્યાને લઈ ટેન્ડર ભરવાનું રહેશે.
- (૩૦) સદરહું કામમાં ફાઈનલ બિલ બનાવતા પહેલા જરૂરી રોયલ્ટી માટે ખાણ ખનીજ વિભાગનું ના વાંધા પ્રમણપત્ર, સિમેન્ટના પાકા બિલો તેમજ માલ-સામાન અને ક્યુબ ટેસ્ટીંગ માટેના એજન્સીએ જે ગર્વમેન્ટ માન્ય લેબોરેટરીમાં પરીક્ષણ કરાવેલ હોય તે લેબોરેટરીના ફી ચુકવેલ હોય તે ફી ના બિલ ૧% મુજબ ટેન્ડરની અંદાજિત રકમનાં રજૂ કરવાના રહેશે.
- (૩૧) સદરહું ટેન્ડર ભરનાર એજન્સીએ સરકારશ્રીનાં શ્રમ અને રોજગાર વિભાગના પરિપત્ર મુજબ પી.એફ. તથા લેબર લાયસન્સની ખરી નકલ રજૂ કરવાની રહેશે અને પી.એફ. ભરવાની જવાબદારી એજન્સીની રહેશે. સંબંધીત કચેરી દ્વારા આ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો જવાબદારી સંબંધીત એજન્સીની રહેશે.
- (૩૨) સદરહું કામમાં એજન્સીએ કામ શરૂ કર્યા પહેલા હેયાત સ્થળ સ્થિતિના ફોટોગ્રાફ્સ અને કામ પુર્ણ થયા બાદના ફોટોગ્રાફ્સ રનીંગ/ફાઈનલ બિલ રજૂ કરતી વખતે સાથે (હાર્ડ કોપી અને સોફ્ટ કોપી) પાંચ નકલમાં કોન્ટ્રાક્ટરશ્રીએ સોનગઢ નગરપાલિકામાં સબમીટ કરવાનાં રહેશે.
- (૩૩) કોઈપણ કામનાં ફાઈનલ બિલ સાથે કામ દીઠ, આઈટમ દીઠ એક્સેસ સેવીંગ સ્ટેટમેન્ટ બીનચુક તૈયાર કરવાના રહેશે. વધારા-ઘટાડાના ખર્ચના અહેવાલ સક્ષમ ઓથોરીટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ ફાઈનલ બીલના પેમેન્ટ ચુકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- (૩૪) કોઈ પણ ગ્રાંટ / અનુદાન હેઠળનાં કામોના બિલ ગ્રાંટ/અનુદાનની રકમની મર્યાદામાં જ ચુકવવામાં આવશે. વધારાના ખર્ચ સક્ષમ ઓથોરીટીના દ્વારા મંજૂર કર્યા બાદ ચુકવવામાં આવશે.
- (૩૫) સરકારશ્રી અનુદાન/ગ્રાંટ હેઠળનાં તમામ કામોમાં સરકારશ્રી નિયુક્ત/નગરપાલિકા નિયુક્ત થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સી પાસે થર્ડપાર્ટી ઈન્સ્પેક્શન કરાવવામાં આવશે અને તેના રીપોર્ટ નગરપાલિકાને મળ્યા બાદ રનીંગ બીલ/ફાઈનલ બીલના પેમેન્ટના ચુકવણા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ થર્ડ પાર્ટી કરાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.

(૩૬) આ કામમાં સરકારશ્રી દ્વારા લાગુ પડતા ટકાવારી મુજબ જી.એસ.ટી. તે એજન્સીના રનીંગ/ફાઈનલ બિલમાંથી કપાત કરવામાં આવશે અથવા કામ કરનાર એજન્સીએ ભરવાનો રહેશે. આ વિગત જાણી એજન્સીએ ભાવ ભરવાનાં રહેશે. આ બાબતે નગરપાલિકા દ્વારા કોઈ પણ એકસ્ટ્રા ભાવ વધારો કે અલગ થી ટેકસ આપવામાં આવશે નહીં. જેની એજન્સીએ ખાસ નોંધ લેવાની રહેશે.

(૩૭) ઉપરોક્ત કામોમાં શરતી ટેન્ડર સ્વિકાર્ય રહેશે નહીં.

(૩૮) સદર કામ અંગેના તમામ હકક નગરપાલિકાને અબાધિત છે.

કોન્ટ્રાક્ટરની સહી

ચીફ ઓફિસર

પ્રમુખ

(નામ :)

નગરપાલિકા સોનગઢ

નગરપાલિકા સોનગઢ